

16th July 2024

Ref: No. ABCL/SD/MUM/2024-25/JULY/10

BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai 400 001

National Stock Exchange of India Ltd

Exchange Plaza, 5th Floor, Plot. C/1, G-Block, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai 400 051 **Symbol: ABCAPITAL**

<u>Scrip Code: 540691</u> Scrip ID: ABCAPITAL

Dear Sir/ Madam,

Sub: <u>Newspaper Advertisement regarding the 17th (Seventeenth) Annual General Meeting</u> of the Company to be held on Friday, 16th August 2024 through Video Conferencing (VC) / Other Audio-Visual Means (OAVM)

Pursuant to the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of newspaper advertisement published today i.e., July 16, 2024, in compliance with circulars issued by the Ministry of Corporate Affairs, in Business Standard, All India Editions in English and Sandesh Rajkot Edition in Gujarati, intimating that the 17th (Seventeenth) Annual General Meeting of the Company will be held on Friday, August 16, 2024, at 11:00 a.m. (IST) through electronic mode (video conference or other audio visual means).

The copies of newspaper advertisements are also being made available on the website of the Company i.e. <u>https://www.adityabirlacapital.com/investor-relations/announcements-and-updates</u>

The above is for your information, records and dissemination please.

Thanking you,

Yours sincerely, For Aditya Birla Capital Limited

Pinky Mehta Chief Financial Officer

Encl.: As above Cc:

Luxembourg Stock Exchange Market & Surveillance Dept., P.O. Box 165, L-2011 Luxembourg, Grand Duchy of Luxembourg

Citi Bank N.A. Depositary Receipt Services 388 Greenwich Street 14th Floor, New York, NY 10013 Citi Bank N.A.

Custodial Services FIFC, 11th Floor, C-54 & 55, G Block Bandra Kurla Complex Bandra (East), Mumbai 400 051

Listing Agent Banque Internationale à Luxembourg SA 69 route d'Esch L - 2953 Luxembourg Grand Duchy of Luxembourg

Aditya Birla Capital Limited Corporate Office: One World Center, Tower 1, 18th Floor, Jupiter Mill Compound, 841, Senapati Bapat Marg, Elphinstone Road, Mumbai, Maharashtra - 400 013

Tel: +91 22 6723 9101 abc.secretarial@adityabirlacapital.com | www.adityabirlacapital.com Registered Office: Indian Rayon Compound,

Veraval, Gujarat – 362 266 Tel: +91 28762 43257 CIN: L67120GJ2007PLC058890

PRISM JOHNSON LIMITED

CIN: L26942TG1992PLC014033 Registered Office : 305, Laxmi Niwas Apartments, Ameerpet, Hyderabad - 500 016 Phone: +91-40-23400218; Fax: +91-40-23402249 e-mail : investor@prismjohnson.in ; website : www.prismjohnson.in Corporate Office : Rahejas, Main Avenue, V. P. Road, Santacruz (West), Mumbai - 400 054

INFORMATION REGARDING 32ND ANNUAL GENERAL MEETING

Dear Members,

The 32nd Annual General Meeting ('AGM') of the members of the Company will be held on Friday, August 9, 2024 at 4:30 p.m. (IST) through Video Conference ('VC')/Other Audio Visual Means ('OAVM') pursuant to the applicable provisions of the Companies Act, 2013 and Rules made thereunder, the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with all applicable circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India, to transact the business set out in the Notice calling the AGM, without the physical presence of the members at a common venue.

The Members are hereby informed that the Notice of the AGM and the Annual Report for the year ended March 31, 2024 shall be sent only through electronic mode to all those members who have registered their e-mail address with the Company or KFin Technologies Limited ('KFin') or with their respective Depository Participant(s) ('DP') or Depositories. Members can participate in the AGM only through VC/OAVM. The Notice of the AGM and the Annual Report will also be available on the website of the Company at www.prismjohnson.in and on the website of Stock Exchanges i.e. BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of Company's Registrar & Transfer Agent, KFin at https://evoting.kfintech.com.

Manner of registering/updating email address :

- i. Members holding shares in physical form may register their email address and mobile number by sending Form ISR-1 duly filled and signed along with requisite supporting documents to KFin at Selenium Building, Tower - B, Plot No. 31-32, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad, Rangareddy, Telangana - 500 032 or by sending scan copies thereof on email at einward.ris@kfintech.com for receiving the Annual Report, AGM Notice and the evoting instructions or register their e-mail address with KFin by clicking on https://ris.kfintech.com/clientservices/mobilereg/mobileemailreg.aspx
- ii. Members holding shares in demat form are requested to update their email address with their DP(s).

Manner of casting vote(s) through e-voting :

Members can cast their vote(s) on the business as set out in the Notice of the AGM through electronic voting system ('e-voting'). The manner of voting, including voting remotely ('remote e-voting') by members holding shares in dematerialised mode or physical mode and for members who have not registered their email address has been provided in the Notice of AGM. Members attending the AGM, who have not cast vote(s) by remote e-voting, will be able to vote through e-voting system during the AGM.

Joining the AGM through VC/OAVM :

Members will be able to attend the AGM through VC/OAVM. The instructions to join the VC/OAVM facility and the manner of participation in the remote e-voting or casting vote through the e-voting system during the AGM are provided in the Notice of the AGM.

Members are requested to carefully read all the Notes set out in the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting or voting during the AGM.

| By order of the Board of Directors, | |
|-------------------------------------|--|
| For Prism Johnson Limited | |

Shailesh Dholakia **Company Secretary & Compliance Officer**

JOHNSON Not just tiles, Lifestyles

Styrenix PERFORMANCE

Date : July 15, 2024

Place : Mumbai

PRISM

दूर की सोच

Styrenix Performance Materials Limited

RMC

Aditya Birla Capital Limited

ADITYA BIRLA

Regd. Office: Indian Rayon Compound, Veraval - 362 266, Gujarat | Tel: 91 2876 243257 CIN: L67120GJ2007PLC058890 | www.adityabirlacapital.com | abc.secretarial@adityabirlacapital.com

INFORMATION REGARDING THE 17th (SEVENTEENTH) ANNUAL GENERAL MEETING OF ADITYA BIRLA CAPITAL LIMITED

The 17th (Seventeenth) Annual General Meeting ("AGM/ Meeting") of the Members of Aditya Ine 1/^a (Seventeenth) Annual General Meeting ("AGM/ Meeting") of the Members of Aditya Birla Capital Limited ("the Company / your Company") will be held on Friday, 16th August 2024 at 11:00 a.m. (Indian Standard Time) through Video Conferencing ("VC") or other Audio Visual Means ("OAVM"), in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder read with Ministry of Corporate Affairs ("MCA") Circulars dated 8th April, 2020, 13th April, 2020, 5th May, 2020 and 25th September, 2023 and the Securities and Evenbance Reard of Ledia ("ESEI") (Liting Obligations and Disclosure Descriptione). Provide Liting Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015 and other applicable circulars issued by SEBI (collectively referred to as **"relevant Circulars**") to transact the businesses as set out in the Notice calling the AGM. Members participating through the VC / OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.

Dispatch of Annual Report:

In compliance with the relevant Circulars, the Notice of AGM along with the Annual Report for the financial year 2023-24, will be sent to all the Members of the Company whose email address(es) are registered with the Company / Depository Participants. The aforesaid documents will also be availa on the Company's website at https://www.adityabirlacapital.com/investor-relations, on the website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively, and on the website of Company's Registra d Transfer Agent, M/s KFin Technologies Limited ("KFinTech") at https://evoting.kfintech.com.

- Manner of registering / updating email address(es):
 - Members holding shares in physical mode, who have not registered / updated their email address(es) with the Company, are requested to register/ update their email address and other a) KYC details, if applicable, by sending request at <u>einward.ris@kfintech.com</u> along with Form ISR-1 and other relevant forms and documents. The format of Form ISR-1 is available on the website of KFinTech at https://ris.kfintech.com/clientservices/isc/isrforms.aspx.
- Members holding shares in dematerialised mode who have not registered their e-mail address(es) with their Depository Participant(s) are requested to register/update their email address(es) with the Depository Participant(s) with whom they maintain their demat accounts.
- Manner of casting vote(s) through e-Voting:
 - a) Members can cast their vote(s) on the businesses as set out in the Notice of the AGM through electronic voting system.
 - The manner of voting remotely (**"remote e-Voting"**) by Members holding shares in dematerialised mode, physical mode and for Members who have not registered their email address(es) shall be provided in the Notice of the AGM which will be available as mentioned aforesaid. b)
 - . The facility for voting through electronic voting system will also be made available at the AGM (**"Insta Poll"**) and Members attending the AGM who have not cast their vote by remote e-Voting will be able to vote at the AGM through Insta Poll.
 - Joining the AGM through VC/OAVM: Members will be able to attend the AGM through d) VC/OAVM at <u>https://emeetings.kfintech.com</u>. The login credentials for casting votes through remote e-Voting and Insta Poll shall be made available to the Members through email. Members who do not receive email or whose email address(es) is not registered with the Company/KFinTech/Depository Participants, may generate login credentials by following the instructions given in the Notes to the Notice of AGM.
- Members are requested to carefully read all the Notes set out in the Notice of AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-Voting or through lnsta Poll during the AGM.

For ADITYA BIRLA CAPITAL LIMITED

Pinky Mehta Chief Financial Officer Abbott Healthcare Private Limited

CIN No.: U24200MH1997PTC104834 3, Corporate Park, Sion-Trombay Road, Mumbai - 400071, India Phone No.: +91-22-50461000/2000 E-Mail.: webmasterindia@abbott.com

Public Notice

(Under Paragraph 21 (2) of the Drugs Price Control Order, 2013)

Attention of the public is drawn to the fact that Abbott Healthcare Pvt Ltd with registered office at the aforesaid address will be discontinuing the scheduled formulation namely Cerom Injection 1500 mg Each Combinack contains: A) Cefuroxime Injection IP 1500mg, Each Vial Contains: Cefuroxime Sodium IP Eq. to Cefuroxime 1500mg (As sterile powder for reconstitution) B) One Ampoule (FFS) of sterile water for injection IP (10ml) (hereinafter referred to as medicines).

After a period of six months from the date of this notice, the Company will discontinue and stop marketing the medicine. Therefore, patients using this medicine may consult their doctor to prescribe an alternate medicine. All doctors/medical professionals may also make note of this

| | Durgesh Paliwa |
|------------------|--------------------------|
| Date: 15.07.2024 | Company Secretar |
| Place: Mumbai | Membership No.: ACS 1333 |

| INVITING EXPRESSION OF INTEREST FOR | |
|---|---|
| SSIGNMENT OF NOT READILY REALIZABLE ASSETS (NR | 7 |
| IND BARATH THERMAL POWER LIMITED IN LIQUIDATION | |

| IND BARATTI THERMAE I OWER EIMITED-IN EIGODATION |
|---|
| (CIN: U40101TG2007PLC052232) |
| (undergoing Liquidation Process vide Order dated 31st March 2023 passed |
| by Hon'ble National Company Law Tribunal, Hyderabad) |

Notice is hereby given to the public in general for inviting the Expression of Interes o submit offer for assignment or transfer of Not Readily Realisable Assets (NRRAS") of Ind-Barath Thermal Power Limited-In Liquidation (the 'Company') nder Regulation 37A read with Regulation 44A of IBBI (Liquidation Process) tegulations, 2016 (Within ambit of IBC, 2016) on **"AS IS WHERE IS, AS IS WHAT IS,** WHATEVER THERE IS AND WITHOUT RECOURSE BASIS" and as such the said on is without any kind of warranties and indemnities.

The deed of assignment and other requisite documents shall be executed fo Information Memorandum for Expression of Interest. The assignment will be subject to the provisions of the IBC, 2016, and Regulations made thereunder and he process document.

| Submission of Expression of Interest | EOI are to be submitted during | | | | |
|--|--|--|--|--|--|
| along with other requisite documents | ts 16th July, 2024 to | | | | |
| and Earnest Money Deposit (EMD) | 05th August, 2024. | | | | |
| Amount of Refundable Earnest Money | t of Refundable Earnest Money Rs. 5,00,000/- | | | | |
| Deposit (EMD) | (Rupees Five Lakhs only) | | | | |
| Providing Requisite Information 06th August, 2024 | | | | | |
| through Virtual Data Room | | | | | |
| Submission of Initial Offer (in password | Initial Offer (in password 14th August, 2024 | | | | |
| protected PDF through email) | | | | | |
| Process Email ID and Communication | IP Deepak Maini | | | | |
| Address Contact No.: 0120-4729400 | | | | | |
| | Email Id: cirp.indbarath@gmail.com | | | | |
| | Address: C-100 Sector 2 Noida | | | | |
| | UP 201301 | | | | |
| The Process Information Memorandum including the list of NRRAs and other | | | | | |

The Process I equisite information can be sought through an Email from the Liquidator at irp.indbarath@gmail.com

Note: The issuance of this FOI does not imply that the Liquidator is bound to selec an applicant/assignee/transferee or to appoint the Preferred applicant/assig transferee as successful applicant/assignee/transferee for the assets of ompany on offer and the Liquidator reserves the right to reject all or any of the offers in consultation with SCC. Deepak Main

Date: 16-07-2024 Liquidator of Ind-Barath Thermal Power Limited IBBI Reg. No.: IBBI/IPA-001/IP-P00676/2017-2018/1114 Place: Noida Address: C-100 Sector 2 Noida UP 201303 Email: cirp.indbarath@gmail.com; Contact No.: 0120-4729400 AFA Validity: 19th November, 2024

₹ (in Crore)

NOTICE FOR LOSS OF SHARE CERTIFICATE GOVINDACHAR K (Deceased), holding 400 shares of Face Value Rs. 1/-in United Breweries Limited having its registered office at UB Tower, UB City, #24 Vittal Malya Road, Bengaluru, Karnataka, 560001 in Folio UB019500 bearing Share Certificate Number 108653 with Distinctive Numbers from 3570031 - 3570430.

Place: Mumbai

Date : 15th July, 2024

I. N RUKMINIYAMMA (PAN GGUPR8722L), bein e claimant, hereby give notice that the said nare Certificate(s) are lost and we have applied to e Company for issue of duplicate Share ertificate. he public is hereby warned against purchasing o

dealing in anyway with the said Share Certificates. The Company may issue duplicate Share Certificates if no objection is received by the Company within 15 days of the publication of this advertisement, after which no claim will be intertained by the Company in that behalf. N Rukr ace : Bengaluru ate : 16.07.2024 N Rukminiyamma Folio No : UB019500



| Particulars | June 30, 2024 | March 31, 2024 | Quarter Ended June 30, 2023 |
|---|---------------|----------------|--------------------------------|
| | (Reviewed) | (Audited) | (Reviewed) |
| Total income from operations (Revenue from operations) | 775.24 | 2,584.37 | 574.54 |
| Net profit for the period (before tax, exceptional and/or extraordinary items) | 752.25 | 2,475.02 | 571.26 |

PERFORMANCE MATERIALS

(formerly known as Ineos Styrolution India Limited) CIN: L25200GJ1973PLC002436

Registered Office : 9th Floor, "Shiva", Sarabhai Complex, Dr. Vikram Sarabhai Marg, Vadiwadi,, Vadodara - 390 023, Gujarat, India. Tele: +91 265-2303201 / 02 E-Mail: secshare@styrenix.com Website: www.styrenix.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND PERIOD ENDED JUNE 30, 2024

| | | For the Quarter ended | | | For the year ended |
|------|--|-----------------------------|--------------------------------|-----------------------------|---------------------------|
| | Particulars | Jun 30, 2024 (Unaudited) | Mar 31, 2024 Refer note - 4 | Jun 30, 2023 (Unaudited) | Mar 31, 2024 (Audited) |
| I | Revenue from operations | 698.71 | 598.71 | 543.77 | 2,222.17 |
| | Other income | 2.48 | 2.39 | 2.11 | 9.26 |
| ≡ | Total income (I+II) | 701.19 | 601.10 | 545.88 | 2,231.43 |
| IV | Expenses | | | | |
| | Cost of materials consumed | 554.17 | 449.55 | 427.55 | 1,666.53 |
| | Changes in inventories of finished goods and work-in-progress | (23.41) | 1.92 | (7.53) | (4.28) |
| | Employee benefits expense | 16.77 | 16.27 | 16.64 | 67.20 |
| | Other expenses | 61.46 | 59.10 | 56.16 | 229.19 |
| | Total expenses (IV) | 608.99 | 526.84 | 492.82 | 1,958.64 |
| ۷ | PBDIT : Profit before Depreciation, Interest and Tax expense (III-IV) | 92.20 | 74.26 | 53.06 | 272.79 |
| VI | Finance Costs | 0.61 | 0.62 | 0.74 | 2.76 |
| VII | PBDT : Profit before Depreciation and Tax expense (V-VI) | 91.59 | 73.64 | 52.32 | 270.03 |
| VIII | Depreciation and amortisation expense | 9.34 | 9.21 | 9.10 | 36.78 |
| IX | Profit before tax (VII-VIII) | 82.25 | 64.43 | 43.22 | 233.25 |
| Х | Tax expense | | | | |
| | Current tax | 21.80 | 15.20 | 11.38 | 61.60 |
| | Deferred tax charge / (credit) | (0.75) | (0.14) | (0.61) | (1.51) |
| | Total tax expense (X) | 21.05 | 15.06 | 10.77 | 60.09 |
| XI | Profit for the Period / Year (IX-X) | 61.20 | 49.37 | 32.45 | 173.16 |
| XII | Other comprehensive income Items that will not be reclassified to profit or loss Remeasurements of defined benefit plans - (Loss) / Gain | 0.04 | 0.10 | 0.21 | 0.16 |
| | Income tax relating to remeasurements of defined benefit plans | (0.01) | (0.02) | (0.05) | (0.04) |
| | Total other comprehensive income, net of tax (XII) | 0.03 | 0.08 | 0.16 | 0.12 |
| XIII | Total comprehensive income for the Period / Year (XI+XII) | 61.23 | 49.45 | 32.61 | 173.28 |
| XIV | Paid-up equity share capital (Face value of the share : INR 10) | 17.59 | 17.59 | 17.59 | 17.59 |
| XV | Other Equity | | | | 705.14 |
| XVI | Earnings per share (Not annualised) Nominal value per equity share of INR 10 each | | | | |
| | Basic and Diluted (INR) | 34.80 | 28.07 | 18.45 | 98.47 |

Notes:

Place : Vadodara

Date : July 15, 2024

1. The above statements were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on July 15, 2024. The statutory auditor have expressed unmodified conclusion on the aforesaid results.

2. The Company operates in "Engineering Polymers" which in the context of IND AS 108 Operating segments constitutes a single reportable business segment.

The financial results of the Company have been prepared in accordance with Indian Accounting ("Ind AS") notified under Section 133 Of the Companies Act 2013 ('Act') read with Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended.

The figures for the quarter ended March 31,2024 are the balancing figures between audited figures in respect of the full financial year and the published year to date figures up to the third quarter of the respective financial year.

For Styrenix Performance Materials Limited (formerly known as Ineos Styrolution India Limited) Rakesh S Agrawal Chairman DIN: 00057955

| Net profit for the period before tax (after exceptional and/or extraordinary items) | 752.25 | 2,475.02 | 571.26 |
|--|--------|----------|--------|
| Net profit for the period after tax (after exceptional and/or extraordinary items) | 603.76 | 1,942.69 | 477.41 |
| Total comprehensive income for the period [comprising profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 600.44 | 1,940.82 | 474.88 |
| Equity share capital | 106.79 | 106.74 | 106.73 |
| Other Equity (excluding revaluation reserve) as at March 31, | | 6,968.27 | |
| Earnings per equity share (Face value of ₹ 5 each) | | | |
| Basic (₹): | 28.28 | 91.00 | 22.37 |
| Diluted (₹): | 28.18 | 90.89 | 22.37 |

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS OF HDFC ASSET MANAGEMENT COMPANY LIMITED (STANDALONE INFORMATION): ₹ (in Crore)

| | | | ((()))) |
|---|--------------------------------|------------------------------|--------------------------------|
| Particulars | Quarter Ended June 30, 2024 | Year Ended March 31, 2024 | Quarter Ended June 30, 2023 |
| | (Reviewed) | (Audited) | (Reviewed) |
| Total income from operations (Revenue from operations) | 775.24 | 2,584.37 | 574.54 |
| Profit before tax | 752.47 | 2,478.19 | 571.36 |
| Profit after tax | 603.98 | 1,945.88 | 477.51 |

Notes:

1. The above standalone and consolidated results of the Company have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company at its meeting held on July 15, 2024. The standalone and consolidated results have been subject to Limited Review by the Statutory Auditors of the Company.

The above is an extract of the detailed format of Quarterly / Annual Financial Results filed with the National Stock Exchange of India Limited and BSE Limited under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Reguirements) Regulations, 2015, as amended. The full format of the Quarterly / Annual Financial Results are available on www.bseindia.com, www.nseindia.com and www.hdfcfund.com.

Navneet Munot | MD & CEO DIN: 05247228


Place: Mumbai | Date: July 15, 2024

CMYK

સિટી

RAJKOT

SANDESH



સિટી બસ અને બી.આર.ટી.એસ.ના તમામ રૂટ ઉપર મુસાફરીની છૂટ મુંબઇથી આવતી ફ્લાઇટ બે ક્લાક મોડી, ૧૪૦ મુસાફરો રઝળ્યા સરધારના હરિપર ગામે તરૂણને વિજશોક લાગતા મોત તુ-મન્પન ખાત્મના સ્વાપ્ય જ ગયાગ માગે, ૧૫૦૫ તુવારેલી 2,004 કાજોરે : મુંભાષા ભારે વરકાશના કારણે સગ્ય કલાઇટના ગેરણુલાં અસર બેવા મળી રહિ છે તેમાં રાજોર હીરાસર એરપોર્ટ પર મુંભાશી ગાલતી કલાઇટ સ્વત બે વિસ્વારી ડીવી થયું દલિ છે. લારો સોમવારો આખો દિવાર તમામ કલાઇટ સમસરા કાલી હતી પરંતુ આખરે મુંભાશી ગાલતી કલાઇટ નંભર-પરદ્ય કરાને બહાર સમસરા કલાઈ તમે બે કલાક મોડી આવી હતી અને ૧૦ વાગ્યે કરી મુંભાજ જવા રવાના થઇ હતી. જેના કારણે ૧૪૦ વેરલા સુધાકરો એરપોર્ટ પર ટઝાળા હતા. રાજકોટ : સરદ્ધારના હરિપર ગામે રહેતા નિવાન દિવીપભાઈ પરમાર ઉ વવરા નામનો તરણ આજે સાંજે સાતેક વાગ્યા આસપાસ પોતાની વાડીએ હતો.ત્યારે લેપ ચાલુ કરવા જતાં વિજશોક લાગતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ત્યારભાદ વધુ સારવાર માટે સિવિલ દિવ્યાંગ,જૂવેનાઈલ ડાયાબિટીક અને સિનિયર હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી કાર્યવાહી હાથ ધરી છે. સિટીઝનને નિઃશુલ્ક પરિવહન<u>સેવા</u> ઝોનલ ઓફીસ - રાજકોટ ઝોન : પરા બજાર, એમ. જી. રોઠ, રાજકોટ. ઈ-હરાજી વેચાણ નોટિસ સિવિક સેન્ટરમાંથી ફોર્મ ભરી પાસ કઢાવીને સેવાનો લાભ લઈ શકાશે बैंक ऑफ़ इंडिया BOI 🛪 हि at 1 - २२३२३८८ और किल्लिप्रे उट्टर अपर उ अबस्य टार्ट्स कर के स्ट्रांस कर के स ા **રાજકોટ**ા રાજકોટ મહાપાલિકાની સિટી ા અને બી.આર.ટી.એસ.માં કઈ રીતે મળશે દિવ્યાંગ અને દર્દીઓને પાસ રાહ્ય. અને બી.આર.ટા.બત્ત... થી "સીનીયર સીટીઝન, '``'∕ુવ્વ કેટેગરી), ચેલેરેમેસાગ્રસ્ત ભુલેનાકલ ડાચાળીટીક, તેમજ દિવ્યાંગોની ૨૧ કેટેગરીમાં સમાવિત્ર મુસાફરોએ બસામાં ક્ષે મૂચાફરીના પાસ મેળાવવા માટે બે પાસપોર્ટ સાઇમના ફોટોચાણસાં કે દ્વોડે ફોમેમાં ચોટાડવો અને એક ફોટો સાલે ભેડવો, ફોટો આઇ.ડી. પૂકની નકલ (પાન કાર્ડવોક્સન કાર્ડડગાદાર કાર્ડડ્રાઇવિંગ હાલાંત્વન્સ), એટ્સ, વર્નના કલદ (પાન કાર્ડગોક્સ કલેક્સ ભાંતો હાલેફ્ટ્સીચી બોલા તેમજ દિવ્યાંગો માટે સિવિલ સર્વનનો દાખલો સંપૂર્ણ ભરેલ અરણપ્રક હવેથી મજ સ્પરક આવે કરવામાં કરવામાં કરવામાં કરવામાં છે. અગલ્યની વારીઓ : મિલ્ડલની તીરીક્ષણની વારીમ અને સમય : ૨૩.૦૭.૨૦૨૪ અને ૨૫.૦૭.૨૦૨૪ (સવારે ૧૧ થી બપોરે ૨ સુધી), ઈએમ.કી. રજૂ કરવાની છેલ્લી વારીમ : ૩૦.૭૭.૨૦૨૪ સાંજે ૪ સુધી, બીક જમા કરવાની છેલ્લી વારીમ : ૩૧.૦૭.૨૦૨૪ સાંજે ૪ સુધી, ઈન્ટરાજીની વારીમ અને સમય : ૩૧.૦૭.૨૦૨૪ બપોરે ૧૧ થી પ સુધી (પ મીનીટના ઓટો એસટેંશન સાથે) દિવ્યાં ગો (૨૧ ાદુધ્ધાળા (૨૧ કટળરા), થેલેસે મીયા ચસ્ત, જુવેના ઇલ ડાયાબીટીસગસ્તને સીટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં ફ્રી મુસાફરી" લોકભોગ્ય યોજનાની 11 2111 (121) (12 ૧૩(૨) દેઠળ નોટીસની તારીખ અને નોટીસ મુજબની રકમ ઉધારકર્તા, પ્રોપરાઇટર અને જામીનદારનાં નામ સ્થાયી અને અસ્થાયી મિલ્કતોને વિગતવાર વર્ણન ક્ષેટ નં. ૬૦૧ : જે વીંગ-બી, સીદી સૅરેનીટી. આલાપ ગ્રીન સીદી પાછળ રેવન્લુ સર્વે નં. ૧૬૦, રેચા, રાજકોટ-૧૬૦ ૦૦૫ ખાતે સ્થિત છે. જે **શી પ્રિયંક દિનેશભાઈ મોદી** ના નામની છે.કારપેટ એરીયા : ૩૭, ૪૦ સ્કે.મી., બિલ્ટઅપ એરીયા : ૪૧,૭૪ સ્કે.મી. (BKID134) તા. ૧૩.૦૩.૨૦૨૩, રૂા. ૧૯,૭૦,૮૬૭.૫૬ + વ્યાજ + અ યાઈસ - ત્યારપછીની જમા કરેલ રીકલ જ્ઞા નુસારગ' લાકભાગ્ય યાજવામાં અમલવારી શરૂ કરાવવામાંઆવી છે. આ માટે પાસ કઢાવીને નિ:શુલ્ક મુસાકરી કરી શકાશે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કહશુંહતું કે, રાજકોટ રાજપથ વિ. દ્વારા બી.આર.ટી.એસ. બસ સર્વિસ સાથે રજુ કરવાના રહેશે. ઉદ્યારકર્તા : શ્રી પ્રિયંકા દિનેશભાઈ મોરી, શ્રી દિનેશભાઈ માવજભાઈ મોરી કંઈ રીતે મળશે સિનિચર સિટીઝનને લાભ દ્દું ૦ વર્ષ કે તેથી વધુ ધ્રિમ્ટ ધટાવતા નકલાપાનકાર્ડ ઇલેક્શન કાર્ડ વરિષ્ઠ નાગરિકોએ શ્રે મુસાફરીના આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસવ્ય પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ(એક ફોર્મમાં કનેક્શન બીલાઇલેકટ્રીક બીલ) રેદેવાંક મહાન ઉદયવની વિલ્લક ? રે 'દાગેન્ચર કુવા', પ્લોર સં, 'ર પેલી (પૂર્વ ગાગ), દેશ, સં, ર. ૨૯, 'ર, સાથ પ્લોર વિશ્વાર, પશુ રાગતાના પારે, કોલીલ્ક ક્રારો, દેશ સં, રે ૧૯, 'ર, સાથ પ્લોર વિશ્વાર, પશુ રાગતાના પારે, કોલીલ્ક કરો સો, 'ર સી ચંદ્રવારા છેનાવા વાગતાં કે (BKD147) ઓધીલ્ક પૈદ્ર કારતાના છે. આ ગાંધ કે પ્રાપ્ત કરીતા પ્લેક્સ્ટ્રીંગ, 'તેક સં, ', ગોના કારીતા ભાગતાં છે. સ્ટારે, રાગલેથાં પ્લોક બાદ કે વ્યુટનેમાં ગાંધ નીલિયની વાન મામલી છે. સ્ટાર ગોના ગોના પ્લોક પ્લોક ક્લેટના પારં નીલીલ્સની વાન મામલી છે. સ્ટાર ગોના ગોના ગોલા પારં છે. ભાગ ગોરેટ, પોર્ટલ પોર્ટ પારં, અડીવા બિક્સ કે રોટ સં, ગોના ગાંધ પારંગ, આ ગોના ગોલ નીલ્સની વાન મામલી છે. સ્ટે ભાગ ગોરેટ, પોર્ટ સં, ગોના ગાંધ પારંગ, આગ છે. પોર્ટલ પોર્ટ માર્ટલ છે. સ્ટે ભાગ ભાગતાં છે. સં, ગોના ગાંધ પારંગ, આગ છે. (BKD149) ઓધીલિક પોર્ટ વાન્ટલ ચેટેના સં, ગોના ગાંધ પારંગ, આ ગાંધ પારંગ, આગ છે. (BKD149) ઓધીલિક પોર્ટના સં, કોમ, સંદલ શાંદ / પ્રેલ્પર સં, પોર્ટ સં, ની ગાંધ વિશ્વાર પારંગ, છે. તેણે સિંદ પોર્ટના, સં, કોમ, સંદલ શાંદ / પ્રેલ્પર સં, પોર્ટ આ વીલ્ટફલિક ચેના ગોંધ ગોલ કે સ્ટ્ર, પાર્ટ પારં આવે છે. (BKD154) તા. ૧૩.૦૯.૨૦૨૨, ૨ૉ. ૩૫,૮૫,૦૦૦,૦૦ + વ્યાજ + અન્ય ચાર્જીસ - ત્યારપછીની જમા કરેલ રીકવરી BK100003129, મો. ના. ૨૦૦૯૯૦ પટ સ્ટ૯ બેન્ક ઓફ ઇન્ડીથા, રાપકોર સેઇન બાંચ એકાઉક્ટ ના રાગ્દર ૨૦૦૯૦ ૨૦૦૦ ૦૦૦ ૩.૧, એકાઉક્ટ નામ : INTERMEDIARY INWARD OUTWARD, REMITTANCE. IFSC Code : BK100003100, મો. ૬૪૧૬૦ ૧૩૩૫૦ આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ) એડ્રેસ પ્રૂફની નકલ(રેશન કાર્ડ/ ગેસ કનેક્શન બીલ/ઇલેકટ્રીક બીલ) સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ ઘારકર્તા : મે. અવઘ ફાસ્ટનર્સ પરાઇટર શ્રી બળવંતભાઈ એમ. વોરા તથા શહેરી બસ સર્વિસમાં વરિષ્ઠ ચોટાડવો અને એક સાથે જોડવો), તેવા શહેરા બંધ સાવેસમાં વારે ક નાગરિકો(સિનિયર સિટીઝન), દિવ્યાંગો, થેલેસેમીયાગસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીક મુસાફરોને શહેરી બુસ સર્વિસ અંતગર્ત મફ્તૂ તા. ૨૩.૦૫.૨૦૨૩, ફા. ૯૬,૬૫,૦૦૦.૦૦ + વ્યાજ + અન્ય ચાર્જા - ત્યારપછીની જસાકરે 24,10 2.41 ારકર્તા : મે. ગોપી પોલી પ્લાસ્ટ ગીદારો : શ્રી રીનલ માધવજીભાઈ લીંબ ભગ્નવાઈ બાબભાઈ લીંબાગીસા ફોટો આઈ.ડી. પ્રફની escimi ska - દરરોજ ૨૨૦૦૦ મુસાફરો સિટી બસ સેવાનો લાભ લે છે 23.00 2.30 - દરરોજ ૨૪૦૦૦ મુસાફર બી.આર.ટી.એસ.માં ફરે છે રાહરા ખત સાવેત અત્યત મસ્ત મુસાકરી કરવા જરૂરી નિયમાનુસારની પક્રિયા પુર્શ કરવામા આવેલ છે.આ યોજનાનો લાભ મેળવવા ક્રી મુસાકરી પાસ માટેના અરજીપતર આજરોજ તા.૧૫ સોમવારથી જ રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક - શહેરમાં નવા ૧૬૪ વાહનો સિટી બસમાં દોડે છે 32.44 3.25 . સેન્ટર તેમજ વોર્ડ ઓક્સિથી મળી 3.30 (ર થી ર.30 રિસેષ) શકશે. જરૂરી આધાર પુરાવા સાથે સુધીમાં સિવિક સેન્ટર તેમજ સંપૂર્ણ વિગતો ભરેલું કેટેગરીવાઈઝ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ફોર્મ, સવારે ૧0.30 થી બપોરે ઓફ્સિસ્વીકારવામાં આવશે. ાર ખલ્લાર ર ૩૩૮.૩૮ ટકામાં. (BKUT94) ઓધોમિક શેક સંલગ્ન સિવિલ ક્લસ્ટ્રકામ ઘરાવતી મિલ્કત : જે પ્લોટ નં ૧૪, ડી.કે. ઉલ્ડરીધલ, અધિવાળા બસ સ્ટેન્ડ સામે, રંબનુ સર્વે નં. ૪૦ પ ૨, ભાવનગર કાયઉ રાજકોટ ખાતે સ્થિત છે. વિસ્તાર ૩૮૯.૫૨ રકે.મી, જે શ્ર તારીખ ૩૧.૦૫.૨૦૨૩ રૂ!. ૪૮,૦૧,૦૦૦.૦૦ + વ્યાજ + અન્ય ચાર્જર જમા કરાવેલ રીકવરી બેન્ક ઓફ ઇન્ડીયા, સોરઠીયાવાડી શાખા એકાઉન્ટ નં. ૩૧૦૪૯૦૧૦૦૦૦૦૩૩, એકાઉન્ટ નામ : INTERMEDIARY INWARD OUTWARD REMITTANCE, રકર્તા : મે. તુલસી મેટલ રાઈટર : શ્રી વિશાલ શાંતિલાલ ચોવટીયા લકત નં. ૬ અને ૭ નં સંચકત વેચાણ ¥2.54 ¥.2.9 ર, ભાવનગર હાઇયે રાજકોટ ખાતે સ્થિત છે. વિસ્તાર ૩૮૯.૫૨ સ્કે.ઝી. જે વિષાલ એસ. ચોવટીયાના નામની છે. (BKID150) યુનિટ ખાતે આવેલ છોટિશન જ્વેલરી માટે વપરાતા પ્લાન્ટ અને મથીનદી (BKID151) IFSC CODE : BKID0003104, મો. નં. : ૯૦૯૯૦ પ્ર૮૩૦૪ બેન્ક ઓફ ઈન્ડીથા, પોરબંદર શાખા એકાઉન્ટ નં. ૩૩૧૧૯૦૨૦૦૦૦૦૩, 16.94 1.64 ચેરમેનને લાંબી મુસાફરીઓ જૂજ કરવાની હોવા છતા ૨૫ લાખનું આંધણ કરાશે મે. શીજી પોલીમર્સ ભાગીદારો : શ્રી રાજેન્દ્રસિંહ મંગળસિંહ જેઠવા શ્રી પૂચ્ચીરાજસિંહ પી. જેવવા, શ્રી જો છેતેન્દ્રસિંહ એમ. જેવવા, શ્રી રવિ એમ. પરમાર "મિલકત નં. ટ અને હ નું સંયુક્ત વેચાણ **.54 1.13 ચુનિટ ખાતે આવેલ કાળેમેથીકેશન કરેલ પ્લાન્ટ અને મથીનથી (BKID153 લીઝફોલ્ડ ઘરાવતી ઓધોનિક જમીન સાથે કારખાનાનો વેક સિવિલ બાંધક સાથેની શિલ્હન : જે પરોટ તે, પપા, વનાણા ઓધોનિક એસ્ટેટ, જૂલાગ પ્રેઝરંદર રોક, ઉત્પૂર્ણ (વનાણા), તાલુકો : રાણાવાવ, જી. પેરબંદર ખ સ્થિત છે, (BKID152) ાથીકેશન કરેલ પ્લાન્ટ અને મશીનરી (BKID153) સ્ટેન્ડિંગ ચેરમેનની સાત વર્ષ જૂની કારને 16.10 1.61 ાસલકત તે. દે અને લ નું ચંચુકત વેચાલા ઉતારકતીઓ છે. તેમન છેદન ઈન્ડરકૂડિ (૧) ત્રીસની (વેટેબને વિદ્વાપનાઈ વાક (૧) ત્રીસની (વેટેબને વિદ્વાપનાઈ વાક (૧) ત્રીસના), (દ) તે તેમને ક્લેશાય અને પ્ ભાગીતારાક), (દ) તેમ (વેટેલોના અને ક્લેશ ત્રી વિદ્વારા છેવે, પાક, (વે!) ભાગાને બેને (દ) લાક, (વો!) કરીવાઈએ એન. સર્કત, (d) વિદ્યાદવાઈ એ, પાક, (a!) બાગાને એન. પાક (૧) વિદ્યારા (૨) (૨) તે વિદ્યુપભાઈ એસ. પાક (૧) તેમ વિદ્યારા (૨) તેમ વિદ્યુપભાઈ એસ. પાક (૧) તેમ વિદ્યારા (૨) તેમ સામય ઇન્ડરફડિંગ (૧) તેમના કે લોક કરવાઈ અંગ તેમના ઉત્યાર્ગ છે. 151.33 15.13 સ્થાને ૨૫ લાખની નવી ગાડી ખરીદાશે કાર ૨.૨૮ લાખ કિમી ચાલતા ખખડી જતા નવી ખરીદીનો બચાવ : આજે સ્ટેન્ડિંગમાં ૪૭ દરખાસ્ત પૈકી ૧૬ આરોગ્ય સહાયનીઃ વર્ગ ૨ના અધિકારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવા મુસદ્દો મે. આગદ ઇન્ડરટ્રીઝ ના નામની કીન્ડીઝના મોર્ગે કરેશ કારબાનની જમીન અને સિન્ડર્ડિંગ (સેક સ્ટાચની સિન્ડર - છે ગરી - ૨૧૮૮ ન, અંગે સિન્ડર્ડિંગ (સેક સ્ટાચની સિન્ડર - છે ગરી - ૨૧૮૮ ન, ગરા છે. આગદ ગરા છે. આગદ ગરા છે. આગદ ગરા છે. આગદ ગરા છે. રાજ્યેદારાઈ, ગેરા છે. આગદ ગરા છે. આગદ ગરા છે. (RUD77) બે. આં, તેમરા સંદેશ આગદ ગાડા સુધાનનગર પાંગે (સેંગ). જે નીના બે. આં, તેમરા સંદેશ આગદ ગાડા સુધાનનગર પાંગે (સેંગ). જે નીના બે. આં, તેમરા સંદેશ આગદ ગાડા સુધાનનગર પાંગે (સેંગ). જે નીના બે. આં, તેમરા સંદેશ આગદ ગાડા સુધાનનગર પાંગે (સેંગ). જે નીના બે. આં, તેમરા સંદેશ આગદ ગાડા સુધાનનગર પાંગે (સેંગ). જે નીના બે. આં, તેમરા સંદેશ બે. આગદ ગાડા છે. સુધાનનગર પાંગે (સેંગ). જે નીના બે. આં, તેમરા સંદર્શ છે. આગદ ગાડા છે. પાંચ છે. આગદ ગાડા ગાડા છે. પાંચ છે. સ્ટેસ સંદર્શ ગાડા છે. આગદ ગાડે છે. આગદ ગાડા છે. આગદ (પત્રામારાટ) ઉદ્યારકર્તાઓ : મે. સાગર ઈન્કસ્ટ્રીઝ (૧) શ્રી પિયુપભાઈ એસ. શાફ (ભાગીદાર), (૨) શ્રી સેવંતીલાલ એમ. શાફ (ભાગીદાર), (૩) યુપ્પાબેન એસ. શાફ (પામીનદાર), (૧) શ્રીમતી વુપ્લિયેન પિયુપભાઈ શાફ (પામીનદાર), 264.20 26.42 તા. ૨૯.૦૪.૨૦૧૯, રૂા. ૧૫,૭૬,૭૪,૮૪૯.૯૯ + વ્યાપ્ટ + અન્ય ચાર્જીસ - વ્ય ા રાજકોટ ા આંધણ કરવામાં આવી રહયં છે. લેવામાં આવી રહી છે. તેનાથી ા ગળગોટા રાજકોટ મહાપાલિકાના ચેરમેન માટે ૨૫ લાખના ખર્ચે નવી ઈનોવા હાઈલિંક ખરીદવા માટે તા ૧૯ના ચેર બાળી રહે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મુકલામાં આવી છે. હાલ વેરમેના પાસે કરવામાં આવી હતી જે ખખશે જતા નવી કાર ૨૦૧૯માં ખરીદ કરવામાં આવી હતી જે ખખશે જતા નવી કારની પરેવારના લાંબી મમાકરી ઓછી સ્ટવાની થશે. લવામાં આવા રહા છે. તમાવા ખર્ચબચશે. આ જૂની કારને રિઝર્વમાં રાખી દેવાશે. મનપાની તા.૧૬ની સ્ટેન્ડિંગમાં ૢ૪૭્ ચેરમેન જયમીન ઠાકરનો સંપર્ક સાધવામાં આવતા તેમણે 283.20 **₹**¥.3₹ કહયું હતું કે, ૨૦૧૬માં આ કાર ખરીદાયેલી હતી અને તે ૨.૨૮ લાખ કિમી ચાલી ગઈ છે. હવે આ તા.૧૬ના સ્ટાન્ડગમા ૪૭ દરખાસ્ત રાખવામાં આવી છે જેમાંથી ૧૬ મેડિકલ સહાયની છે. બેન્ક ઓફ ઇન્ડીયા, કાલાવડ રોડ બ્રાંય રાજકોટ. ાધારકર્તા : મે. ભવ્ય ફર્નિચર ોપરાઈટર : શ્રી યોગેશ ચીમનલાલ ગજ્જર 16.13 1.41 বাহীস ০3.0२.२०२० ३१. १,२१,८०,૯०८.୨ + બ્યાજ + અल्य ચાર્જસ ยางตั้ง: ฟอเด็จะ ค่. 311090200000033, ฟิธเด็จะ ค่เม : INTERMED INWARD OUTWARD IECO ก લાખ કિમી ચાલી ગઈ છે. હવે આ કાર ઘણા બધા ખર્ચા કરાવી રહી હોવાથી નવી ખરીદારી વિચારાઈ છે. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનની ગાડી એક સાથે ખરીદાઈ હતી જેમાંથી ૨૦૧૮માં કમિશનર માટે નવી કાર આવી જે માયા ૧૮ માડકહ સહાયમા છે. આ ઉપરાંત વિવિધ શાખામાં મેન પાવર તેમજ ખરીદારીની દરખાસ્તો મૂકાઈ છે. મનપાના ઈજારેદાર્ દ્વારા અપાતા ચાલકોને INTERMEDIARY BKID0003110, พ). ๔๏๔๔๏ ч८३१० 1.03 લઘુમત વેતન દર આપવા પણ 11 10.34 રહા છે. જો કે, ચરમપપ લોળો મુસાફરી ઓછી કરવાની થતી હોય છે. મોટા ભાગની કામગીરી શહેરમાં ફરીને કરવાની હોવા છતા રપ લાખના ખર્ચે નવી કારનું દરખાસ્ત આવી છે. વર્ગરના દરખાસ્ત આવા છે. વગ રના અધિકારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવા માટે પણ ચર્ચા કરવામાં આવનાર છે. ગામરાપર માટે પૈયા કાર આપા ગઈ છે. સ્ટેન્ડિંગ ચેરમેનની ગાડી ખખડધજ બની છે નવી ગાડી જરૂરી હતી એટલે હાઈબિડ કાર ના નાસની છે. (BKID90) ના નાસના છ. (BRID90) પ્લાન્ટ અને મશીનરીઝ : જે સર્વે નં. ૨૫૫/૧, જુના સાદુરકા, ૨૦ રોક, સોરબી - ૩૬૩૬૪૨ ખાતે સ્થિત છે. (BKID60) તા. ૧૮.૦૫. રૂા. ૧,૯૨,૯૫,૦૦૦, અન્ય યાર્જસ -ฝิดรามิธุย์คริโมเ, อาชามิธ มิย์ค ซเพเ ฟิลเซีอะ ส. 3.100 e0 จ.000 อ.3.3, ฟิลเซีอะ ส.ท.ม : INTERMEDIARY INWARD OUTWARD REMITTANCE IFSC CODE : BKID0003100, พ.ศ. : ๔ ช จ.ช ว.3.40 ડેઘારકર્તા: મે. સ્પીનેલા માઇકોન્સ, સર્વે હં. ૨૫૫/૧, જુહાં સાટુટકા, રવાપર હદી રોડ, મોરબી ૩૬૩ ૬૪૨ પ્રાગીદારો - જાગીનદારો - (૧) શ્રી અલિલબાઈ 3.9.90 3.95 રપપ ', પુત્યા શાટુલા, સ્વાપ તથી છેક, મોરાવી શેદ, કોરાવી - 35.3757 પછા છે છેલા છે, (SKDBD) - 35.377 ભાષેદારો ', ખાદી માટો ', () કી અનિવાર કારખાનાં ની પણ માન એ વિલ્લી ક ' કે વાસ વારં તે પા પા પી, પૂત્રા ભાષેદારો ', ખાદી માટે ', પા પા પી, પૂત્રા () કી આ કેલ્ટલા કારખાનાં ' સારવાર કોર્ડ કે વાસ પ્રત્ના કેલી પણ ', પા પી, પૂત્રા ((પર્વાદાર', ''milects), (s) કી અનિધ સ્વરુદ્ધ સ્વરંગ કેલ્ટે કોર્ડ કોર કોર્ડ કોર કોર્ડ કોર કોર્ડ કોર કોર કોર કોર્ડ કોર્ડ કોર્ડ કોર કોર્ડ ક 56.60 5.00 ADITYA BIRLA આદિત્ય બિરલા કેપિટલ લિમિટેક ศโหย]ฐศ สนุโดช: ยโตรินด วันโด สะบุ(5.ธ., นิวเนต – 362 266, บูจะบก i ğin: 91 2676 243257 CN: L67120612007PLE053890 i www.adityabirlacamital.com i abc.secretaria@adityabirlacamital.com રહેલાંક શહેર નં. ૧૦૧ રૂપે પહેલો માળા, 'બોલેનાઇ રાવર-એ' તરીકે ઓગમાતુ વિલ્દરીમ, 'હાલેર સાર' તરીકે ઓગમાતો વિસ્તાર, ગેમાં બિલ્દાગ્ય એશિ પર લુદ્ધારુપ, પ્રાથમિંગ તે કરે, કરી પર વિસ્તાર, ગેમાં વિલ્દાગ્ય એશિ પર લુદ્ધારુપ, પ્રાથમિંગ તે કરી કરી પર વિસ્તાર પ્રાથમિંગ તે કરી પ્રાથમિંગ રાકાર્ય / બી, વાર, રાગ્લોર ખાલે રહેતા છે. જે ટેનેન્ક્સાઈ કી, કેવા માં માનની છે. (BKID138) ฝิงธ ฟาธุ ฮงร์ไขเ, ธเตเฉร ชิเร เล่น, ฟิธเชิงะ ศ. 311090200000033, ฟิธเชิงะ ศเท : INTERMEDIARY INWARD OUTWARD, IFSC Code : BKID0003110, พิ. eoeeo นะอาจ 16.93 તા. ૨૪.૦૫.૨૦૨૧, રૂ. ૨૧,૬૬,૪૫૮.૪૫ + લ્યાજ + અલ આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની 17મી (સત્તરમી) વાર્ષિક સાધારણ સભા સંબંધે માહિતી આદાટલ ભારતા કાયવતા ધામવટા ધામવટાના 1/માં (સ્તાટલના) ધામાક તામાંચાટલે સમય તમાર માહિતા અહિત્ય બિટલ પ્રેટિંગ દિવારિંગ કે પ્રેલ્ડ પ્રતિક્ર છે કે પ્રેલ્ડ પ્રતિક્રિયાં કે પ્રેલ્ડ પ્રતિક્ર કે પ્રેલ્ડ પ્રતિક્રિયાં પ્રોલં પ્રાણ પ્લોક સ્વાતા ક્ ("એપ્રુએમ (બેટન") કંપની દારા 20:3માં તથી ત્વરુ સાચાયકો અને કોર્પ્રેટ તાન્સોમાં મંગલાય ("એપ્સીમેં') માં પોત્રાગતા તેમાં કા મોં કોરિંગ, 2005, માં કે પ્રેલ્ડ, 2005, માં 3, 2000 અને કલી મંગદર, 2005, માં ગ્રેલ્ડ મેં ગ્રેલ્ડ, 2005 અને કે પ્રેલી મંગદર, 2005, માં દેવારી મંગદર, 2005, માં ગ્રેલ્ડ માં ગ્રેલ્ડ પ્રેલ્ડ પ્લોક પ્રેલ્ડ પ્રેલિયાં પ્રેલ્ડ પ્લિમ્બો પ્લોકના પ્રેલ કાર્યાં પ્રેલ કે બેઠા કે બેઠાવી ત્વર તેમાં પ્લોકના પ્લોક સ્વાર્યા પ્લોકના પ્રેલ કાર્યાં પ્રેલ કે બેઠાવી ત્વર તે પ્રેલી પ્લોકના પ્લેલ પ્લોક પ્રેલકના પ્રેલ કાર્યાં પ્રેલ કે પ્રેલ કે બેઠાવી ત્વર પ્લોકના પ્લોકના પ્લોકના પ્લોકના કે માં ગ્રેલ્ડ કિંગ પ્લોકના પ 2014 કા પ્લાક પાર્વન પ્લોકના પ્લ લા ભાગ અને ગેલ સાવિતની સેવાક ગિલન ધરાવતી શિકલા ૨ રે રેલ્ડ છે. જેવી ન સરક ગે ને પસ સિલ્લો સેવાક ગિલન ધરાવતી શિકલા ૨ રે રેલ્ડ બે ને ગેલે ગે ગે ને 'પસે, સાર પર પોર્ટ, 'પર, સરાર પોર્ટ, 'પ્ર, ક્યાર પોર્ટ, 'પ્ર, ક્યાર પોર્ટ, 'પ્ર, ક્યાર પોર્ટ ગોસવાઈ કોરેલ પોર્ટન પરસાર અને શી ચેલન ક્રિપોર પ્રસાર ના નામતી છે. (RKD98) તારીખ ૧૯.૧૧.૨૦૨૧ રૂા. ૧૪,૭૩,૯૧૨.૭૭/- + વ્યાજ અન્ય ચાર્જસ - ત્યારપછીની જમા કરાવે રીકવરી ઉદ્યારકર્તા : શ્રીમતી ચંદ્રિકા ચેતન પર ચેતન કિમોર પરખ્ય 14.33 બેન્ક ઓફ ઈન્ડિયા, શંકર ટેકરી SSI શાખા, એકાઉન્ટ નં. 32529020000033, એકાઉન્ટ નામ : INTERMEDIARY INWARD OUTWARD, IFSC Code : BKID0003252, ત્રો. ૯૦૯૯૦ ૫૮૩૫૨ અનેલોએનીક બિલકલા ન છે ટેલાનુ સપી તાં. ૧૬૧, ૧૧ પીડી, પ્લોટ તાં. સર કેલિકી, અને પ્લોટ તાં. શરૂ / પા, મણલિર ઇન્ડસ્ટ્ર્લિયલ એરીમા, લોકાલ-કોટડા આંખાણી શે રાક્ષ, ગામ 1 લોકાડ, તા અને છે, સ્ટર્બકોટ ખાતે વિરેત છે, જેનો વિરતા ૮૮. ૧૪ કરે, નીટલે છે, જે **ની મેકુલ્ભાઇ ફરિયલ ઇ** માલ્લીમા ના લામની છે [EKID110] તારીખ ૦૮.૦૬.૨૦૨૧ રૂા. ૩૪,૦૨,૯૩૫.૫૯/- + વ્યાજ અન્ય ચાર્જીસ - ત્યારપછીની જગા કરા રીકવરી BRIDUUUU202, માં. ૯૦૯૯૦ પટ કપર બેન્ક ઓફ ઈન્ડિયા, માર્કેટ થાર્ડ શાખા, એકાઉન્ટ નં. 31199020000033, એકાઉન્ટ નામ : INTERMEDIARY INWARD 15.93 વિષદ 12:08 કપાઇ (પરાદીય તેમાં ગુમુલા) પાંચાંતાં, આંગ પોંચવાયાં પણ પાંચાંતાં માટે પાંચ પાંચ (પરાદી માટે વાંપ્ય કે અના પાંચ 2015ની કપાઇ (100 કરીવાંપ્રામાં છુંની પાંચામાં વિષ્યા) વાર્ષિક શ્રેશભાવું વિવરણ સુલખાવેના પાંચ બેંદરા કે પ્રેચનું વિષ્ઠિ સરમાનું પાંચા ગિયા છે તે કે પાંચા પાંચ પાંચા ગયો છે. આ ગયો, તે સાહેતિ દાર્વતોને કે પાંચી વિગરણ કે પ્રેચનું વિષ્ઠિ સરમાનું પાંચા ગયો છે તે કે પાંચા થયા થયાને છે કે પાંચા પાંચા તે કરી સુલખાવેના પાંચા છે બેંધરાર કે પ્રેચનું પ્રેચનું કે પાંચા ગયો છે. આ ગયો છે બેંધરાં છે પાંચા થયા છે પાંચા છે કે પ્રેચના છે પાંચા છે. સંદર્ભનો છે પાંચી બેંધરાર છે કે પ્રેચનું પ્રેચનું કે પ્રેચનું કે પાંચા છે પાંચ છે પાંચા છે પાંચ છે પાંચ છે પાંચ છે પાંચ છે પાંચ છે પાંચ છે પાંચા છે પ ઉધારકર્તા : મે. ફાર્વી એન્ટરપ્રાઈઝ (પ્રોપરાઇટર) મેફુલભાઇ ફરિભાઇ માલવીથા *બિયારન નં. ૧૦ અને ૨૦ નં સંચક્ત વેચાણ 2 UTWARD REMITTANCE, IFSC Code ID0003119, N. COCCO 42310 (ISREETTS) બુસ્ટર પંપ અને સંલગ્ન ઉત્પાદનો મેન્યુફેકચર્શગ માટે વપરાતા પ્લાન્ટ ર મશિનરી (BKID111) 6.23 0.63 20 સાચર (DNDFFF))મંચાંચિક દુકાલ : વે રાજકોટ સીટી સર્વે વોર્ડ નં. ૮, સીટી સર્વે નં. ૭૦૫ પેકી અહુ, લગ્દ પેંકી અને લગ્દ થી બરુર, ઓફીસ નં. ૩૬, જેનો બિલ્ટઅ રીયા ૧૨.૪૫ સ્ટે. મીટર્સ છે તે બીજો માળ, શ્રીમદ ભવન, ભાંડિતનગ રાસાથી, ટોર્ડ નં. ૧, રાજકોટ ખાંતે સ્થિત છે. જે શ્રી મનસુખભાઈ બેચરભા અન્ય બાદ છે તે પ્રિયાગવર 6.91 0.60 કેદારકર્તા : મે. શ્રી સહજાનંદ બફ વર્કસ પોપરાઇટર : શ્રી મનસખભાઈ બેચરભા તારીખ ૦૫.૦૮.૨૦૨૨ ફા. ૨૯,૦૫,૨૮૪.૬૯/- + વ્યાગ અન્ય ચાર્જીસ - ત્યારપછીની જમા કરા રીકવરી 3. (IND) મની છે. (BKID123) Сне ъде индени, члеске илия манисне и ЗЗТ19820000033, занисне и ЗТ19820000033, занисне и ИНТЕМИЕЛИАТИ НИЧКАВО ОЦТИАЛО, НЕАЛІТАЛСЕ, IFSC Code: вКЛО003311, м), есее хисаста без еди избез и илия, занисне и, затаче съсоковала, занисне и, затаче съсковала, занисне и констранции, занисне и съсковала, констранции, констранции, съсковала, констранции, съсковала, констранции, съсковала, констранции, констрани, констранции, констрани, બુસા લા લામબી છે. (BKID123) કહેર જે સીટી ગયેં વોર્ડ લં. રૂ. શ્રેર્પે લં. રકકર પૈકી, ક્લેરે લં. સી-૩૦૩, પહેલો માળ, કદમ સી, વસુંઘરા કોમ્પલેશ, એમ.ડી. એમ. સ્કૂલ સામે, પોરબંદર, ૩૩૯ પછપ, ગુરવાલ માતે સ્થિત છે. જેની માલીકી મી કમલેશકુમાર ધીરજલાલ તકવાણીના નામની છે. વિસ્તાર કપ.ક૧૮ રહે. મીટર્સ. (BKID126) તા. ૦૮.૦૩.૨૦૨૨ રૂા. ૧૬,૭૪,૦૯૨.૩૩ સાખ + વ્યાજ અન્ય ચાર્જસ - ત્યારપછીની જમા કરે રીકવરી ઉદ્યારકર્તા સ્વ. શ્રી ક્રમલેશ ઘીરજલાલ તકવાણી, કાયદાકીય વારસદાર શ્રીમતી પાયલ તકવાણી 17.70 ાં માંગો ઇમારો દરશી બાદવાંગ માંગાંગ) તેમાં છે કે બાદમાં કે કબ્લાના માંગા ડ. 1. મંગોટિંગ કેવી બાદવાંગ માંગો માંગો કે બેટ્ટુ છે કે બેટુ છે કે બાદ કે બાદ પ્રાપ્ત કામકાર પર દેશના વોટ (ટ્રા) આવી લકે છે. છે. ડાંગો ડીઇટીલર વોટેગ માંગો, માંગો માંગળનાં વેરેડ ધારાવા સખ્યો અને "મારો ઇમિડેક સરમાણે(માં) તોમાંગાં નહીં વૈશ તેવા સખ્યો માટે શિકેટી નારામ ("સિવેક ઈનવીટિંગ") કરવાની પહોંગ બેટું છે કેમના આપવાં આવી છે, જે તલાકીંગ તેવી ઉપરવધ શેર ઉદ્યારકર્તા રહે, શ્રી રામ પેકેઝુંગ ઈન્ડસ્ટ્રીઝ ભાગીદારો / કાયરેકટરો શ્રી ફિંસલપાઈ ડી. માલાણી, શ્રી દિલેશભાઇ બી. માલાણી, શ્રી ડુંગરભાઈ જી. કામાણી, શ્રી ફસ્ટ્સલબાઈ એસ. સાયલીથા, શ્રી તુપારભાઈ પી. રકોણાંક મકાન ર જે ગોલ્ડન પાર્ક - ૧. (દાસજી પરા), સબ પરોટ નં. ૩૬ / ૩ પૈકી, રેચા ટેલિફોન એસપેન્જ પાછળ, ૧૫૦ કુટ રિંગ રોક, રાજકોટ ખાવે સ્થિત છે. જેનો વિસ્તાર કપ.૨૦ સ્ટે. મીટર્સ, જે **શી તુપારભાઇ પરસોત્તમભાઇ** રંગાણી ના નામની છે. તારીખ ૦૧.૦૩.૨૦૨૩ શ. ૪,૮૧,૪૯,૮૭૪/ + વ્યાજ + અન્ય ચાર્જીસ જમા કરાવેલ રીકવરી 44.34 પાયાગમાં પડાક ઉપલબ્ધ થશે. (શે) છેરિટ્ટ્રોલિક વોટિંગ સિસ્ટમ શકી મતદાન માટે સુવિધા એજીએમમાં (**''ઈલ્સ્ટા પોલ''**) પણ ઉપલબ્ધ કરાશે અને એજીએમમાં હાજરી આપવા પણ મિત્રેટ ઈ-વોટિંગથી તેમના મત નહીં આપ્યા હોય તેવા સબ્ચે એજીએમમાં તેમના મત આપી શકી, આપ પછતા. વીંચી, ઓચેવીએમ વેધી એપ્ટ્રુએમમાં નેકાવું: સબ્યે <u>https://emeetings.thintech.cem</u> પર વીંસી / એએવીએમ શકી એપ્ટ્રાએમાં ભારતી આપી શકી, શિરોદા ઈન્પીટેસ અને શિરુદ્ધ પોલ થકી માંતો આપવા માટે લોગવાનાં સોકિકાર ઉપરિત્ વેકે વાંગ્યોને ઉપરબ્ધ કરતો, ઈપિંડ માટે માટે નો વીં લો અપર શાર્ષિય સ્વત્સાયું એક મિશ્કે ક્લિટેટ (સ્વિક્સ) ક્લિકેટ સરભાગીએ પાસે નોહોરવો હાથે વિંધ તેવા સરબો એપ્ટ્રાએમનાં સૂંદાનામાં નોહિમાં સાપલામાં આવેલી સુસાનકોનું પાલન 5)) ૈઈ.એમ.ડી.ની રકમ ઈન્દ્રરાજી એજન્સી ebkray (link : https://ebkray.in) ના વોલેટમાં એાનલાઈન જમા કરાવવાની રહેશે. મહેરબાની કરીને નોંધ લો કે સફળ બીકર દ્વારા બિલકતની રૂા. પ૦ લાખ કે તેથી વધુની કિંમતની બિલકત હોય તેના ઉપર 1% લેખે TDS ચૂકવવાનો રહેશે વેચાણના ભિષમો અને શસ્તો અંગેની વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ : www.bankofindia.co.in/Dynamic/Tender મહેરબાની કરીને નોંધ લો કે બિડરે કેન્દ્ર/ રાજ્ય/ અન્ય સંરથાઓ દ્વારા વસુલવામાં આવતા તમામ આકસ્પિક ખર્ચાઓ જેવા કે મિલકત/ પાણી/ વીજળી, કર અને અન્ય ખર્ચાઓ અંગે જવાબદાર ટહેશે. સભ્યોને એજીએમની સૂચનામાં આપવામાં આવેલી બ જોડાવાની સૂચના, રિમોટ ઈ-વોટિંગ થકી મત આ ધ્યાનથી વાંચવાની વિનંતી છે. ". વેલી બધી નોંધ, જે નિશ્વત સમયે કરતી કરવામાં આવશે અને ખાસ કરીને એજીએમમ ત આપવાની અથવા એજીએમ દરમિયાન ઈન્સ્ટા પોલ થકી મત આપવાની પદ્ધતિ સરફેસી એકટ દ્વેઠળ ઉધારકર્તા/ જામીનદાર/ મોર્ગેજરને વૈધાનિક - ૧૫ દિવસીય વેચાણ નોટીસ આદિત્ય બિરલા કેપિટલ લિમિટેક વતી ઉપરોક્ત જણાવ્યા મુજબના ઝણકર્તા/જામીનશર કલમ-૧૩ (૨)ની નીટિસમાં જણાવ્યા મુજબની રકમ દરાજીની તારીબ પહેલા પુરેપુરી જમા કારવી દેવી, જેમાં નિષ્ઠળ થવાથી મિલકતનું દરાજી/ વેચાણ કરવામાં આવશે, અને પછી કંઈ પણ લેણું રહેશે તો તે ઝાણકર્તાઓ/જામીનદારો પારેથી વ્યાજ સાથે વસુલ કરવામાં આવશે. પિંકી મહેતા ારીખ : ૧૬.૦૭.૨૦૨૪, સ્થળ : રાષકોટ (આ ક્ષરછ નોરિસનું એકેછમાંથી અન્ય ભાષામાં અનુવાદ કરતી વખતે કોઈ સતિ થયેલ પછાયે તો અસલ એકેછ લમાણ મુખ્ય માન્ય ગણાવે) સફી/- અધિકૃત અધિકારી, બેંક એફ ઈન્ડિયા તારીખઃ 15મી જુલાઈ, 2024 ાલમાં આજીપ્રસાય શીક